

Seat No. : _____

NE-113

November-2013

B.A. (Sem.-III)

Geography

Core 203 : Cartographic

Time : 2 Hours]

[Max. Marks : 30

સૂચના : (1) સૂચના પ્રમાણે કરો.

Instructions : Do as directed.

(2) સ્વચ્છ આકૃતિ બનાવી સમજાવો.

Draw a neat figure and explain.

(3) જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે.

Figures on the right indicate marks.

1. નકશો એટલે શું ? નકશાનાં પ્રકારો સમજાવો. 10

What is the meaning of Map ? Explain the different types of Maps.

અથવા/OR

પ્રમાણમાપ એટલે શું ? પ્રમાણમાપનાં પ્રકારો સમજાવો.

Define scale. Explain the types of scales.

2. નકશાનું આંકૂચન અને વિસ્તૃતિકરણ સમજાવો. 10

Explain the reduction and enlargement of Maps.

અથવા/OR

(A) તુલનાત્મક પ્રમાણમાપ

Comparative scale

(B) સ્તંભ આલોખ

Bar-graph

3. (A) નીચેના પ્રશ્નોનાં જવાબ વિકલ્પોમાંથી પસંદ કરી આપો :

5

Answer the following questions choosing from the options given in the brackets :

(i) નકશાનાં મૂળભૂત અંગો ક્યા છે ? (ભુપૃષ્ઠ, પ્રક્ષેપ, વસ્તી)

Which of the following is a fundamental part of a Map ?

(Projection, Relief, Population)

- (ii) આંકુચન-વિસ્તૃતિકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે ? (લંબચોરસ, સમચોરસ, ટ્રિકોઝા)
 Which method is used for the enlargement and reduction of Maps ?
 (Rectangle, Square, Triangle)
- (iii) નકશાનાં પ્રમાણમાપથી શું જાડી શકાય ? (વસ્તી, ખેતી, અંતર)
 What information can be gathered from the scale of a Map ?
 (Distance, Population, Agriculture)
- (iv) સાધનિક પદ્ધતિ ક્યા સાધન દ્વારા થાય છે ? (પેન્ટોગ્રાફ, હૈપરગ્રાફ, બરોગ્રાફ)
 Which of the following is used in the Instrumental Method ?
 (Pantograph, Hythergraph, Barograph)
- (v) તુલનાત્મક પ્રમાણમાપમાં કેટલા પ્રમાણમાપની તુલના થાય છે ? (એક, બે, ત્રણ)
 How many different types of scales are compared in a comparative scale ?
 (One, Two, Three)

(B) જોડકાં ગોડવો :

5

Match 'A' and 'B' :

(અ) / (A)	(બ) / (B)
(i) નકશો	(a) આલોખાત્મક પદ્ધતિ
Map	Graphical Method
(ii) આંકુચન	(b) 1:20,00,000
Reduction	1:20,00,000
(iii) રેખા-આલેખ	(c) વસ્તી વિષયક નકશાઓ
Line-graph	Population Map
(iv) પ્રમાણમાપ	(d) સમચોરસ પદ્ધતિ
Scale	Square Method
(v) નકશાનો પ્રકાર	(e) ખેતી
Types of Map	Agriculture
	(f) પ્રક્ષેપ
	Projection
